



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક/લઘુલિપિ અને ટાઈપીંગ/મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઈટ <https://gpsec.gujarat.gov.in/> પર ઉપલબ્ધ છે.

ક્રમ	જગ્યાનું નામ	જાહેરાત ક્રમાંક	પ્રાથમિક/મુખ્ય લેખિત કસોટીની તારીખ અને સમય	પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તા.
(૧)	(૨)	(૩)	(૪)	(૫)
૧	પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨	૨૪/૨૦-૨૧	૨૦/૦૬/૨૦૨૧-૧૦:૦૦ થી ૬:૦૦	૧૧/૦૬/૨૦૨૧
૨	ચેરીટીતંત્રના સંચુકત ચેરીટી કમિશ્નર, વર્ગ-૧	૧૨૨/૨૦-૨૧	૨૩/૦૬/૨૦૨૧-૧૧:૦૦ થી ૨:૦૦	૧૪/૦૬/૨૦૨૧
૩	એનેસ્થેટીસ્ટ, વર્ગ-૧ (કા.રા.વિ.યો.)	૧૧૩/૨૦-૨૧	૨૩/૦૬/૨૦૨૧-૧૧:૦૦ થી ૨:૦૦	૧૧/૦૬/૨૦૨૧
૪	કાયદા મદદનીશ, વર્ગ-૩ (ગાંધીનગર મનપા)	૧૦૪/૨૦-૨૧	૩૦/૦૬/૨૦૨૧-૧૧:૦૦ થી ૫:૦૦	૧૮/૦૬/૨૦૨૧
૫	સાયકીટ્રીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧	૮૦/૨૦-૨૧	૩૦/૦૬/૨૦૨૧-૧૧:૦૦ થી ૨:૦૦	૧૮/૦૬/૨૦૨૧
૬	જનરલ સર્જરી ના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧	૮૧/૨૦-૨૧	૩૦/૦૬/૨૦૨૧-૧૧:૦૦ થી ૨:૦૦	૧૮/૦૬/૨૦૨૧
૭	મદદનીશ પ્રાધ્યાપક, કોમ્પ્યુટર સાયન્સ વિષયના, વર્ગ-૨	૭૦/૨૦-૨૧	૩૦/૦૬/૨૦૨૧-૧૧:૦૦ થી ૨:૦૦	૨૧/૦૬/૨૦૨૧

નોંધ:

(૧) જાહેરાત ક્રમાંક ૨૪/૨૦૨૦-૨૧ OMR પદ્ધતિથી લેવાશે અને તમામ ઉમેદવારોએ નવેસરથી પ્રવેશપત્ર (call letter) ડાઉનલોડ કરવાની રહેશે, અગાઉનાં પ્રવેશપત્ર માન્ય ગણાશે નહિ. તે સિવાય તમામ જાહેરાતો Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી લેવામાં આવશે. CBRT બાબતે અદ્યતન જરૂરી સુચનાઓ/માહિતી આયોગની વેબસાઈટ પર થી મેળવવાની રહેશે. CBRT પદ્ધતિથી લેવાતી પ્રાથમિક કસોટીઓ માટે ઉમેદવારોએ પરીક્ષાનાં દિવસે પરીક્ષા ખંડમાં પરીક્ષાનાં નિયત સમયથી એક કલાક પહેલાં અચૂક હાજર થવાનું રહેશે. (૨) ઉક્ત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગ નિર્ણય કરેલ છે ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-પ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર, હાજરીપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે. તે સિવાય જા.ક. ૨૪ અને ૧૦૪/૨૦૨૦-૨૧ ની પરીક્ષાઓ માટે સંબંધિત ઉમેદવારોએ ફક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) જ ડાઉનલોડ કરવાનું રહે છે જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.

(૩) પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્તેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) <https://gpsec-ojas.gujarat.gov.in> પર જવું. (૨) “Call Letter/Form” >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form” પર “Click” કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની “Job Select” કરવી તથા “Confirmation Number” અને “Birth Date” ટાઈપ કરવાના રહેશે. (૪) હવે “Print Call Letter” પર “Click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. હાજરી પત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટાવાળું હાજરીપત્રક પરીક્ષા ખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરી પત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટાવાળું ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.

ખાસનોંધ:- પોસ્ટઓફિસ/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી (સરનામું: ચેરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડથી ભરવાના રહેશે અથવા <https://gpsec-ojas.gujarat.gov.in> માં -> FEES MODULE માં -> PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઇન પ્રોસેસ ચાર્જ ૫૦૦ ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પદ્ધતિ આપનાં રૂપીયા ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર નીકળે તો આપે આજ મોડયુલમાં વિગતો ભરીને “CHECK YOUR PAYMNET STATUS” પર ક્લિક કરીને સ્થિતિ જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઈટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા ps2sec-gpsec-ahd@gujarat.gov.in પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્રમ, કન્ફર્મેશન અને અરજી ક્રમ ની વિગત મોકલવી.

follow us on: @GPSEC OFFICIAL



<https://gpsec.gujarat.gov.in>



GPSEC (Official)



તારીખ-૧૦/૦૬/૨૦૨૧